


# મરચાંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ



NAVSARI AGRICULTURAL UNIVERSITY



આર્થ અનુપ  
ICAR



પ્રવિદ્યાકુમાર મોટી, વિષય નિષ્ઠાંત (બાગાથત)  
ડૉ. સી. ડી. પંડ્યા, પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (ICAR)

નવસારી કૃષિ યુનિવર્સિટી  
એન્ફ્રીકલ્યર પોલીટેકનીકની સામે,  
બેંસકાત્રી રોડ, પાનવાડી, વ્યારા, જી. તાપી.  
કોન નં. ( ૦૨૬૨૬ ) ૨૨૧૮૬૬

યુનિવર્સિટી પ્રકાશન નંબર : ૬૬/૨૦૧૪-૧૫

# મરચાંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

મરચાં એ એક અગ્રત્યનો શાકભાજુનો પાક છે. તાજા લીલા મરચાં શાકભાજુ તરીકે તથા લાલ સૂક્ષ્મા મરચાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટ ફૂડ), અથારાં વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચાંમાં ફોઝ્ફરસ, કેલિશાયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચાંમાં ગોસની તકલીફ અને સંદ્ઘાનો દુઃખાવો દૂર કરવાના ઔષધીય ગુણો પણ રહેલા છે.

તાપી જિલ્લામાં ખાસ કરીને નિજર તાલુકામાં લાલ અને બીજા તાલુકાઓમાં લીલા મરચાં માટે ખેતી કરવામાં આવે છે.

## મરચાંની સુધારેલી જતો

વિગત	એસ ૪૯	જીવીસી ૧૦૧	જીવીસી ૧૧૧	જીવીસી ૧૨૧
રોપણી પછી પ્રથમ વીણીના દિવસો	૫૦-૫૨	૫૦-૫૨	૪૨-૫૦	૪૫-૪૭
ઇડની ઉચ્ચાઈ (સે.મી)	૬૦	૬૫	૬૪	૮૦
સરેરાશ મરચાંની સંખ્યા/ઇડ	૧૫૦	૧૪૫	૨૧૦	૧૬૦
મરચાંની લંબાઈ (સે.મી)	૧૦.૮	૧૧.૮	૧૪.૫	૧૦.૩
મરચાંની જાડાઈ(સે.મી.)	૩.૧	૩.૬	૩.૧	૩.૪
મરચાંનો રંગ	આઢો લીલો	લીલો	લીલો	લીલો
મરચાંનો દેખાવ	સીધા, સુંવાળા, આકર્ષક અણીવાળા	સીધા, સુંવાળા, ચળકતા આકર્ષક	સીધા, રફ સપાટી પણ ચળકતા અણીવાળા	સીધા, સુંવાળા ચળકતા, અણીવાળા
સરેરાશ ઉત્પાદન (કિવન્ટલ/હે.)	૧૨૦	૧૪૫	૧૨૦	૧૩૦
અન્ય ખાસિયત	મદ્યમ તીખા	મદ્યમ તીખાં એસ.૪૯ ફૂરતાં ૨૦% વધારે ઉત્પાદન આપે છે.	તીખાં, જવાવા કરતા ૩૮% વધુ ઉત્પાદન આપે છે.	વધારે તીખાં, જી-૪ કરતા ૪૫% વધુ ઉત્પાદન આપે છે.

## આબોહવા :-

મરચાં સમશીતોષ્ણ આબોહવા વાળા વિસ્તારમાં વર્ષાયુ અને ઉષણ આબોહવાવાળા વિસ્તારમાં બહુવર્ષાયુ વૃદ્ધિ કરનારો છોડ છે. આ પાક ૨૦૦૦ મીટરની ઊંચાઈ સુધી ઉગાડી શકાય છે. ભારતમાં આ પાકની વર્ષાયુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. આ પાકના વૃદ્ધિકાળ દરમ્યાન ગરમ અને સૂકું જ્યારે ફૂલ-ફળ આવવાના સમયે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫° સે. ઉષણતામાન આદર્શ ગણાય છે. વધુ ગરમી અને ઉચ્ચ ઉષણતામાનને કારણે ફૂલ અને ડાળીઓ ચીમળાઈ જાય છે, તેમજ પરાગરજ સૂકાઈ જવાના કારણે છોડ ઉપર ફળ ખૂબ ઓછા વિકાસ પામતા હોય છે. ૩૫° સે. કરતાં વધારે તાપમાન કારણે મરચાં ઉપર દાગવાના ડાઢા પડતા હોય છે જ્યારે ખાસ કરીને ફુલનીકરણના અભાવે ફળ બેસતા નથી અથવા તો બી વગરના અથવા ઓછા બી વાળા નાના ફળ રહેતા હોય છે. ખૂબ જ નીચા તાપમાનને કારણે આ પાકને હિમ લાગતું હોય છે. વધુ પડતો અને સતત વરસાદ ફળ અને ફૂલ બેસવાને અસર કરે છે, ફળ-ફૂલ ખરી પડતા હોય છે તેમજ મોટા લીલાં ફળ કહોવાઈ જતા હોય છે. ફળ, ફૂલ આવવાના સમયે ભેજની ખેંચના કારણે પણ ફળ-ફૂલ ખરી પડતા હોય છે.

## જમીન અને જમીનની તૈયારી:-

ગોરાડુથી મધ્યમ કાળી અને ભાઠાની સારા નિતારવાળી ફળદ્વારા જમીન વધુ માફક આવે છે તેમ છતા રેતાળ જમીનમાં પુરતા પ્રમાણમાં સેન્ટ્રિય તત્ત્વ ઉમેરી આ પાકની ખેતી કરી શકાય છે. મે માસ દરમ્યાન જમીન ખેડી તપવા દેવી. ચોમાસા પહેલા ૧૫ થી ૨૦ ટન સાર કહોવાયેલું છાણિયું અથવા ગળતિયું ખાતર નાંખવું. શક્કા હોય તો જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં શાણ જેવા પાકનો લીલો પડવાશ કરવો.

## ફેરારોપણી :-

મરચાંનો રોપણી માટેનો આદર્શ સમય ૧૫ ઓગષ્ટથી ૧૫ સાએમ્બર વચ્ચેનો સમયગાળો ગણાય. આ સમયગાળા દરમ્યાન ઝરમર છળવો વરસાદ પડતો હોય ત્યારે ફેરારોપણી કરવાથી છોડ સારી રીતે ચોંટી જાય છે. સામાન્ય રીતે ૫ થી ૬

અઠવાડિયા પછી ધરની ઊંચાઈ ૧૫ થી ૨૦ સે.મી. જેટલી થાય ત્યારે તંદુરસ્ત ધર પસંદ કરી બે ચાસ અને બે છોડ વચ્ચે દુ૦ સે.મી (જમીનની પ્રત અને ફળદ્રપતા પ્રમાણે રોપણી અંતરમાં વધાયા કરવી) અંતર રાખી, એક ખામણા દીઠ બે છોડ રોપવા. આ બે છોડ વચ્ચે ૫ સે.મી. જેટલું અંતર રાખવું. છોડના થડમાં માટીનો લૂંઘો મુકી બારબર દબાવવા તેથી જમીનમાં પોલાણ ન રહે, જમીનમાં પોલાણ રહેવાથી રોપેલ છોડ ટળી પડે છે, મૂળમાં પાણીનો ભરાવો થવાથી મૂળ કોણવાઈ જાય છે પરિણામે છોડ ચીમળાઈ મરી જાય છે. છોડની રોપણી ઉગાડેલ ચાસની એક બાજુએ કરવી જેથી છોડના થડમાં પાણીનો ભરાવો ન થાય. રોપણી પછી ૧૦ થી ૧૨ દિવસ બાદ ખાલાં પૂરવાં તેમજ વરસાદમાં પડી ગયેલા છોડ ઉભા કરી થડમાં માટી દબાવવી.

## રાસાયણિક ખાતર:-

મરચીના છોડની ઊંચાઈ તથા પાનનો વિસ્તાર બોરોનનાં ર થી ૪ પીપીએમનાં છંટકાવથી વધારી શકાય છે. ગુણવત્તાની દસ્તિએ જોઈએ તો બોરોનની પૂર્તિની એસ્કોર્બિક એસિડ કેપ્સેસીન અને કલોરોફીલ “એ”, “બી” તેમજ કુલ કલોરોફીલનું પ્રમાણ વધે છે. મરચાંના પોષણ વ્યવસ્થામાં જો પોટેશિયમ અને જસતની પૂર્તિ એક સાતે કરવામાં આવે તો ઉત્પાદનમાં વિશેષ ફાયદો થાય છે.

- આ પાકની ફેરરોપણી પહેલાં ધર છોડને ધરવાડિયામાં જ ડાયમીથોએટ અથવા ટ્રાઇઝોફોસ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
- ધર / છોડની ફેરરોપણી બાદ વરસાદ ન હોય તો જરૂર પ્રમાણે છળવું પાણી આપવું ભરાયેલ વધારાની પાણીનો નિકાલ કરવો.
- ઉભા પાકમાં જરૂરિયાત મુજબ આંતરખેડ અને નીંદામણ કરવું. નીંદામણ માટે પેન્ડીમીથાલીન (૧ કિ.ગ્રા./હે) અથવા ઓક્સિડાયઝોન (૦.૫ કિ.ગ્રા./હે) અથવા ફલુકલોરાલીન (૧ કિ.ગ્રા./હે) નીંદણનાશકનો ભલામણ મુજબ છંટકાવ કરવો.
- પાકની ફેરરોપણી પછી ૧૦-૧૨ દિવસે ગામાં પૂરવા. મરચી પાકની શરાખાતમાં વૃદ્ધિ ધીમી હોવાથી એક કરતાં વધારે વખત ગામાં પૂરી શકાય.

- એક ખામણે મરચાંના બે છોડ રોપવા અને બે છોડ વચ્ચે ૫-૭ સે.મી. અંતર રાખવું.
- પાકની પૂર્તી વૃદ્ધિ થયા પછી છેલ્લી આંતરખેડ વખતે કરબડીના દાઢા પર કાથી વંટાળી એક તરફી આંતરખેડ કરી છોડના થડમાં આટી ચડાવવી.
- વરસાદના દિવસો સિવાય જમીનના પ્રત પ્રમાણે પાકને ૧૫-૨૦ દિવસના ગાળે પાણી આપવું.
- ફુલઃફુળ આવ્યા પછી જમીનમાં ભેજની ખેંચ ન વરતાય તે ખાસ ધ્યાન રાખવું અને ફુળ ઉત્તરવાની શરૂઆત થયા પછી પાણી આપવાનો ગાળો જરૂર જણાય તો દુંકાવવો.
- ડિસેમ્બર -જાન્યુઆરી દરમ્યાન જયારે જયારે હિમપાતની શક્યતા જણાય ત્યારે પિયત અવશ્ય આપવું.
- મરચાં પાકમાં વારંવાર જસતં અને લોહિતત્વની ઉણપ જણાતી હોય છે તે માટે ઝીક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને બોરેકનો છંટકાવ કરવો.
- વધારે ઠંડીના દિવસોમાં નાઈટ્રોજન આપવાથી શ્રીકેસર લાંબા જાય છે અને ફૂલ ખરી પડે છે.
- **વીણી પછી ની ભાવજત**
- મરચાંની વીણી ૨૦-૨૨ દિવસના સમયાંતરે કરવી જેથી લીલા મરચાંનો જરૂરી વિકાસ અને વૃદ્ધિ થાય. કુમળા મરચાંની જાળવણી (સેલ્ફ લાઇફ) ઓછી કરે છે જયારે વધુ પડતા પાકટ મરચાં વીણી કર્યા પછી લાલ થઈ જતા હોય છે.
- ગરમીના દિવસોમાં મરચાંની વીણીનો સમયગાળો ઓછો કરવો.
- વીણી વખતે મરચાં (ફુળ)ને ડીટા સાથે તોડવાથી આવા મરચાંનો જાળવણી સમય (સેલ્ફ લાઇફ) વધારી શકાય.
- મરચાંની વીણી પછી ગ્રેડીંગ કરવું. પાન, ડાળી ડીટા વગરના

મરચાં અને લીલી દ્વારા અને એન્થેકનોગ્જના નુકશાનવાળા મરચાં વીણી અલગ કરવા.

- વિકસીત નુકશાન વગરના ડીટાવાળા મરચાંનું પ્લાસ્ટિકના છવાની અવરજવર થાય તેવા ખાસ કન્ટેઇનરમાં પેકિંગ કરવું.
- મરચાં વધુ પડતા દબાણ સાથે કન્ટેઇનરમાં ભરવા નહીં તેમજ પાણીનો છટકાવ કરવો નહીં.
- મરચાંનું પેકીંગ અને લોડીંગ દબાણ સાથે કરવું નહિ.